

**પરિશિષ્ટ-IV (C)**

એપ્લિકેશન નં. : તારીખ :



બેંકનું નામ

ફોટો માટેની જગ્યા

**પ્રધાનમંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ લોન માટેનું એપ્લિકેશન ફોર્મ  
(શીશુ અંતર્ગત રૂપિયા 50000 સુધીની લોન માટે)**

**લોન જ્યાંથી લેવાની હોય તે બેંક અને શાખાનું નામ :**

હું \_\_\_\_\_ માટે રૂપિયા \_\_\_\_\_ ની કેશ કેડિટ/ઓવરડ્રાફ્ટ/ટર્મ લોન માટે  
એપ્લિકેશન કરું છું.

|                                         |                                           |            |                         |          |                |
|-----------------------------------------|-------------------------------------------|------------|-------------------------|----------|----------------|
| આવેદકનું નામ                            | 1.                                        |            | પિતા/ પતિનું નામ        | 1. શ્રી  |                |
|                                         | 2.                                        |            |                         | 2. શ્રી  |                |
| બંધારણ ( )                              | વ્યક્તિ                                   | સંયુક્ત    | ભાગીદારી                | અન્ય     |                |
| રહેઠાણનું સરનામું                       | ભાડે/ પોતાનું                             |            |                         |          |                |
| વ્યવસાયનું સરનામું                      | ભાડે/ પોતાનું                             |            |                         |          |                |
| જન્મ તારીખ                              | ઉંમર                                      |            | લિંગ : પુરુષ / સ્ત્રી   |          |                |
| શૈક્ષણિક લાયકાત ( )                     | અભણ                                       | 10 ધોરણ    | 12 ધોરણ                 | સ્નાતક   | પ્રોફેશનલ અન્ય |
| કેવાઈસી દસ્તાવેજ                        | મતદાર ઓળખપત્ર નંબર                        | આધાર નંબર  | ડ્રાઈવિંગ લાઈસેન્સ નં.  | કોઈ અન્ય |                |
| ઓળખના પુરાવા (ફૂપા કરીને સ્પષ્ટ કરો)    |                                           |            |                         |          |                |
| એડ્રેસના પુરાવા (ફૂપા કરીને સ્પષ્ટ કરો) |                                           |            |                         |          |                |
| ટેલીફોન નંબર                            | મોબાઈલ નં.                                | ઈ-મેલ      |                         |          |                |
| વ્યવસાય ગતિવિધિની લાઈન                  | વર્તમાન                                   | અવધિ       |                         |          |                |
|                                         | પ્રસ્તાવિત                                |            |                         |          |                |
| વાર્ષિક વેચાણ                           | વર્તમાન                                   | પ્રસ્તાવિત |                         |          |                |
| અનુભવ જો હોય તો                         |                                           |            |                         |          |                |
| સામાજિક શ્રેણી (ફૂપા કરીને ટિક કરો)     | સામાન્ય                                   | અ.જા.      | અ.જ.જા.                 | અ.પ.વ.   | લઘુમતી સમુદાય  |
| જો લઘુમતી હોય તો ( )                    | બૌદ્ધ                                     | મુસ્લિમ    | ખ્રિસ્તી                | સીખ      | જૈન પારસી અન્ય |
| જરૂરી લોનની રકમ                         | સીસી/ ઓડી - રૂપિયા _____                  |            | ટર્મ લોન - રૂપિયા _____ |          |                |
| વર્તમાન ખાતા(ઓ) ની જાણકારી જો હોય તો.   | પ્રકાર (ફૂપા કરીને ટિક કરો) (ડિપોઝીટ/લોન) |            | બેંક અને શાખાનું નામ    |          |                |
| ખાતા નંબર                               | જો લોન ખાતું હોય તો લીધેલ લોનની રકમ       |            | રૂપિયા                  |          |                |

**ધોષણા**

હું/અમે આથી પ્રમાણિત કરીએ છીએ કે મેં/અમે પ્રસ્તુત કરેલી માહિતી સત્ય, સાચી અને પૂર્ણ છે. એપ્લિકેશનમાં દર્શાવેલ માહિતી સિવાય યૂનિટ માટે મારી/અમારી કોઈ દેણદારી વ્યવસ્થાઓ નથી. મારી/અમારી પાસેથી કોઈ બાકી લેણા/કાનૂની લેણા નીકળતા નથી. મારી/અમારી એપ્લિકેશનના સંબંધમાં બેંકને જરૂર હોય તેવી અન્ય તમામ પ્રકારની માહિતી હું/અમે પ્રસ્તુત કરીશું. આ માહિતી તમને યોગ્ય લાગે તે અન્ય એજેન્સીને પણ તમે આપી શકો છો. તમે, તમારા પ્રતિનિધિઓ અથવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અથવા મુદ્રા લિમિટેડ અથવા તમારા દ્વારા પ્રાધિકૃત કોઈ અન્ય એજેન્સી ઉપર દર્શાવેલ અમારા ફેક્ટરી/વ્યવસાય પરિસરમાં કોઈપણ સમયે મારી/અમારી સંપત્તિઓ, ખાતા વહીઓ વગેરેનું તપાસ/નિરીક્ષણ કરી શકો છો. તમે બેંકની બાકી નીકળતી રકમ માટે યોગ્ય સલામતી/પગલા લઈ શકો છો.

તારીખ : \_\_\_\_\_

સ્થાન : \_\_\_\_\_ આવેદક (કો) નો/ની અંગુઠો / સહી  
(ફક્ત કાર્યાલયીન પ્રયોગ માટે)

પાવતી નંબર \_\_\_\_\_ એપ્લિકેશન નંબર \_\_\_\_\_ તારીખ \_\_\_\_\_

\_\_\_\_\_ દ્વારા પ્રાપ્ત  
સ્થાન અને તારીખ પ્રાધિકૃત સહી કરનાર (શાખાનો સીલ અને સહી)  
અહીંથી ફાડો

પીએમએમવાય અંતર્ગત લોન એપ્લિકેશન માટેની પાવતી નંબર \_\_\_\_\_ (ફક્ત આવેદકની કોપી)

શ્રી/શ્રીમતી \_\_\_\_\_ ની રુપિયા \_\_\_\_\_ માટેની લોન એપ્લિકેશન તારીખ \_\_\_\_\_ મળી.

સ્થાન અને તારીખ પ્રાધિકૃત સહી કરનાર (શાખાનો સીલ અને સહી)

પરિશિષ્ટ-  
IV (D)



Bank's Logo

બેંક નું નામ : .....

પ્રધાનમંત્રી મુદ્રા યોજનાનું લોન એપ્લિકેશન ફોર્મ  
(એક લિસ્ટ પ્રમાણે દસ્તાવેજો સાથે પ્રસ્તુત કરવું)

A. કાર્યાલયીન પ્રયોગ માટે :

| ઉદ્યમનું નામ | એપ્લિકેશન અનુ ક. | શાખાનું નામ | શ્રેણી     |
|--------------|------------------|-------------|------------|
|              |                  |             | કિશોર/તરુણ |

B. વ્યવસાય સંબંધી માહિતી :

|                                                                                                       |   |               |          |              |               |                            |       |
|-------------------------------------------------------------------------------------------------------|---|---------------|----------|--------------|---------------|----------------------------|-------|
| ઉદ્યમનું નામ                                                                                          |   |               |          |              |               |                            |       |
| બંધારણ                                                                                                | √ | પ્રોપ્રાઇટરી  | ભાગીદારી | પ્રાઇવેટ લિ. | લિમિટેડ કંપની | અન્ય કોઈ (વિનિર્દિષ્ટ કરો) |       |
| વ્યવસાયનું વર્તમાન સરનામું                                                                            |   | રાજ્ય         |          |              |               |                            |       |
|                                                                                                       |   | વ્યવસાય પરિસર |          | √            | ભાડાનું       | પોતાનું                    |       |
| ટેલિફોન નંબર                                                                                          |   |               |          | મોબાઇલ નંબર  | 91            |                            |       |
| ઈ-મેલ:                                                                                                |   |               |          |              |               |                            |       |
| વ્યવસાય ગતિવિધિ                                                                                       |   | વર્તમાન       |          |              |               |                            |       |
|                                                                                                       |   | પ્રસ્તાવિત    |          |              |               |                            |       |
| આરંભ થયાની તારીખ (ડીડી/એમએમ/વાયવાયવાયવાય)                                                             |   |               |          |              |               |                            |       |
| શું યુનિટ રજીસ્ટર્ડ છે                                                                                |   | √             | હા       |              |               | ના                         |       |
| જો રજીસ્ટર થયેલ હોય તો (ફૂપા કરીને દર્શાવો: રજીસ્ટ્રેશન નંબર અને જે અધિનિયમ હેઠળ રજીસ્ટર થયેલ હોય તે) |   |               |          |              |               |                            |       |
| રજીસ્ટર્ડ ઓફિસનું સરનામું                                                                             |   |               |          |              |               |                            |       |
| સામાજિક શ્રેણી                                                                                        |   | √             | અ.જા.    | અ.જ.જા       | અ.પ.વ.        | લઘુમતી સમુદાય              |       |
| જો લઘુમતી સમુદાય હોય તો                                                                               | √ | બૌદ્ધ         | મુસ્લિમ  | ખ્રિસ્તી     | સીખ           | જૈન                        | પારસી |

C. પ્રોપ્રાઇટર/ ભાગીદાર/ ડાયરેક્ટરોની પૃષ્ઠભૂમિની માહિતી :

| ક્ર.સં. | નામ | જન્મ તારીખ | લિંગ | ધરનું સરનામું મોબાઇલ નંબર સહિત | શૈક્ષણિક યોગ્યતા | ગતિવિધિની લાઈન નો અનુભવ (વર્ષ) |
|---------|-----|------------|------|--------------------------------|------------------|--------------------------------|
| 1.      |     |            |      |                                |                  |                                |
| 2.      |     |            |      |                                |                  |                                |

| ક્ર.સં. | આઈડી પુરુ | આઈડી પુરુ | સરનામાનું પુરુ | સરનામાના પુરુનો નંબર | પાન કાર્ડ/ડીઆઈએન નંબર | બેંકના અધિકારિયો/ડાયરેક્ટરો સાથે સંબંધ જો કોઈ હોય તો |
|---------|-----------|-----------|----------------|----------------------|-----------------------|------------------------------------------------------|
| 1.      |           |           |                |                      |                       |                                                      |
| 2.      |           |           |                |                      |                       |                                                      |

D. સહયોગી કંપનીઓના નામ અને સંગઠનનો પ્રકાર :

| સહયોગી કંપનીનું નામ | સહયોગી કંપનીનું સરનામું | હાલ કોની સાથે બેંકિંગ કરી રહ્યા છે | સહયોગી કંપનીની પ્રકૃતિ | સહયોગી કંપનીના પ્રોપ્રાઇટર/ ભાગીદાર/ ડાયરેક્ટર અથવા ફક્ત નિવેશક તરીકેનો ભાગ |
|---------------------|-------------------------|------------------------------------|------------------------|-----------------------------------------------------------------------------|
|                     |                         |                                    |                        |                                                                             |

|  |  |  |  |  |
|--|--|--|--|--|
|  |  |  |  |  |
|--|--|--|--|--|

E. વર્તમાન બેંકિંગ/કેડિટ સુવિધાઓ : (રકમ રૂપિયામાં)

| સુવિધાનો પ્રકાર                                                                                                                                                                                                | હાલ કોની સાથે બેંકિંગ કરી રહ્યા છે | ઉપલબ્ધ સીમા | તા. .... પર શેષ રકમ | નોંધાવેલ જામીનગીરી | સંપત્તિ વર્ગીકરણની સ્થિતિ |
|----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|------------------------------------|-------------|---------------------|--------------------|---------------------------|
| બચત ખાતું                                                                                                                                                                                                      |                                    | લા.નહીં     |                     | લા.નહીં            |                           |
| કરન્ટ ખાતું                                                                                                                                                                                                    |                                    | લા.નહીં     |                     | લા.નહીં            |                           |
| કેશ કેડિટ                                                                                                                                                                                                      |                                    |             |                     |                    |                           |
| ટર્મ લોન                                                                                                                                                                                                       |                                    |             |                     |                    |                           |
| એલસી/બીજી                                                                                                                                                                                                      |                                    |             |                     |                    |                           |
| જો આ બેંક સાથે બેંકિંગ કરતા હોય તો ગ્રાહક આઈડી અહીં દર્શાવો :                                                                                                                                                  |                                    |             |                     |                    |                           |
| આથી પ્રમાણિત કરવામાં આવે છે કે અમારા યૂનિટે ભૂતકાળમાં કોઈ અન્ય બેંક / નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધી નથી અને મેં/અમે ઉપર કોલમ ઈ માં દર્શાવેલ સંસ્થા સિવાય કોઈ અન્ય બેંક / નાણાકીય સંસ્થા પાસેથી લોન લીધેલ નથી. |                                    |             |                     |                    |                           |

F. પ્રસ્તાવિત કેડિટ સુવિધાઓ : (રકમ રૂપિયામાં)

| સુવિધાનો પ્રકાર | રકમ | કયા પ્રયોજન માટે જરૂર છે | પ્રસ્તુત કરેલ પ્રાથમિક જામીનગીરીનું વિવરણ (અનુમાનિત મૂલ્ય સાથે દર્શાવવામાં આવે) |
|-----------------|-----|--------------------------|---------------------------------------------------------------------------------|
| કેશ કેડિટ       |     |                          |                                                                                 |
| ટર્મ લોન        |     |                          |                                                                                 |
| એલસી/બીજી       |     |                          |                                                                                 |
| કુલ             |     |                          |                                                                                 |

G. કાર્યકારી મૂડીના મામલામાં : કેશ કેડિટ લિમિટનો આધાર : (રકમ રૂપિયામાં)

| વાસ્તવિક વેચાણનો અંદાજ |             |       |                    |            |         |        |                    |       |
|------------------------|-------------|-------|--------------------|------------|---------|--------|--------------------|-------|
| નાણા વર્ષ -            | નાણા વર્ષ - | વેચાણ | કાર્યક્રમ મહીનામાં | ઈન્વેન્ટરી | દેવાદાર | લેણદાર | પ્રમોટરોનું યોગદાન | સીમાઓ |
|                        |             |       |                    |            |         |        |                    |       |

H. ટર્મ લોનની જરૂરિયાતના મામલામાં, મશીનરી/ઉપકરણોની વિગતો અહીં દર્શાવવામાં આવે :

| મશીન / ઉપકરણોનો પ્રકાર | જરૂરિયાત માટેનું પ્રયોજન | સપ્લાયરનું નામ તેના જીએસટી નંબર સાથે | મશીનની કુલ કીમત | પ્રમોટરો દ્વારા કરવામાં આવેલ યોગદાન (રૂપિયા) | જરૂરી લોન (રૂપિયા) |
|------------------------|--------------------------|--------------------------------------|-----------------|----------------------------------------------|--------------------|
|                        |                          |                                      |                 |                                              |                    |
|                        |                          |                                      |                 |                                              |                    |
| કુલ                    |                          |                                      |                 |                                              |                    |

|                                                              |  |
|--------------------------------------------------------------|--|
| અનુરોધ કરવામાં આવેલ મોરેટોરિયમ સમયગાળા સાથે ચુકવણીનો સમયગાળો |  |
|--------------------------------------------------------------|--|

I. ભૂતકાળનું પ્રદર્શન / ભવિષ્યનો અંદાજો : (રકમ રૂપિયામાં)

| કાર્યકારી મૂડી સુવિધાઓ માટે ભૂતકાળનું પ્રદર્શન / ભવિષ્યનો અંદાજો (પાછલા બે વર્ષનું વાસ્તવિક પ્રદર્શન, વર્તમાન વર્ષનો અંદાજો અને આવનાર વર્ષનો અંદાજો ઉપલબ્ધ કરવામાં આવે. તદઉપરાંત ટર્મ લોન સુવિધાઓ માટે લોનની ચુકવણીના પ્રસ્તાવિત વર્ષ સુધીનો અંદાજો ઉપલબ્ધ કરવામાં આવે.) |                             |                            |                           |                         |
|--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------|-----------------------------|----------------------------|---------------------------|-------------------------|
|                                                                                                                                                                                                                                                                          | પાછલા-II વર્ષ<br>(વાસ્તવિક) | પાછલા-I વર્ષ<br>(વાસ્તવિક) | વર્તમાન વર્ષ<br>(અંદાજીત) | આવનાર વર્ષ<br>(અંદાજીત) |
| ચોખ્ખું વેચાણ                                                                                                                                                                                                                                                            |                             |                            |                           |                         |
| ચોખ્ખો નફો                                                                                                                                                                                                                                                               |                             |                            |                           |                         |
| મૂડી (કંપનીના મામલામાં ચોખ્ખી સંપત્તિ)                                                                                                                                                                                                                                   |                             |                            |                           |                         |

J. કાનૂની જવાબદારીઓ સંબંધી સ્થિતિ :

| કાનૂની જવાબદારીઓ                                 | શું પાલન કરવામાં આવ્યું<br><br>(હા/ના સિલેક્ટ કરો)<br>જો લાગૂ ન પડતું હોય તો લાગુ નહીં સિલેક્ટ કરો | ટિપ્પણી<br><br>(સંબંધિત જવાબદારી પ્રત્યેનું કોઈ કનેક્શન હોય તો તેની માહિતી આપવી) |
|--------------------------------------------------|----------------------------------------------------------------------------------------------------|----------------------------------------------------------------------------------|
| 1. દુકાન અને સ્થાપના અધિનિયમ અંતર્ગત રજીસ્ટ્રેશન |                                                                                                    |                                                                                  |
| 2. એમએસએમઈ અંતર્ગત રજીસ્ટ્રેશન (કામચલાઉ /અંતિમ)  |                                                                                                    |                                                                                  |
| 3. ડ્રગ લાઈસેન્સ                                 |                                                                                                    |                                                                                  |
| 4. ફાઈલ કરેલું નવીનતમ વેચાણ વેરા રિટર્ન          |                                                                                                    |                                                                                  |
| 5. ફાઈલ કરેલું નવીનતમ આવક વેરાનું રિટર્ન         |                                                                                                    |                                                                                  |
| 6. કોઈ અન્ય શેષ રહી ગયેલ કાનૂની લેણાં            |                                                                                                    |                                                                                  |

K. ધોષણા :

હું/અમે આથી પ્રમાણિત કરીએ છીએ કે મેં/અમે પ્રસ્તુત કરેલી માહિતી સત્ય, સાચી અને પૂર્ણ છે. એપ્લિકેશનમાં દર્શાવેલ માહિતી સિવાય યૂનિટ માટે મારી/અમારી કોઈ દેણદારી વ્યવસ્થાઓ નથી. મારી/અમારી પાસેથી કોઈ બાકી લેણા/કાનૂની લેણા નીકળતા નથી. મારી/અમારી એપ્લિકેશનના સંબંધમાં બેંકને જરૂર હોય તેવી અન્ય તમામ પ્રકારની માહિતી હું/અમે પ્રસ્તુત કરીશું. આ માહિતી તમને યોગ્ય લાગે તે અન્ય એજેન્સીને પણ તમે આપી શકો છો. તમે, તમારા પ્રતિનિધિઓ અથવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અથવા મુદ્રા લિમિટેડ અથવા તમારા દ્વારા પ્રાધિકૃત કોઈ અન્ય એજેન્સી ઊપર દર્શાવેલ અમારા ફેક્ટરી/વ્યવસાય પરિસરમાં કોઈપણ સમયે મારી/અમારી સંપત્તિઓ, ખાતા વહીઓ વગેરેનું તપાસ/ નિરીક્ષણ કરી શકો છો. તમે બેંકની બાકી નીકળતી રકમ માટે યોગ્ય સલામતી/ પગલા લઈ શકો છો.

|                   |                   |                   |
|-------------------|-------------------|-------------------|
| ફોટો માટેની જગ્યા | ફોટો માટેની જગ્યા | ફોટો માટેની જગ્યા |
|-------------------|-------------------|-------------------|

(ઉપર લગાવેલ ફોટામાં પ્રોપ્રાઈટર/ભાગીદાર/ ડાયરેક્ટરની સહીઓ)

તારીખ :\_

સ્થાન :\_\_



પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લોન એપ્લિકેશન માટેની પાવતી  
આવેદકની કોપી :

|                                          |  |                      |  |
|------------------------------------------|--|----------------------|--|
| એપ્લિકેશન (સિસ્ટમ જનરેટેડ/મેન્યુઅલ) નંબર |  | એપ્લિકેશનની તારીખ    |  |
| આવેદક (કો) નું/ના નામ                    |  | આવેદન કરેલ લોનની રકમ |  |
| આવેદક (કો) ની સહી                        |  | શાખા અધિકારીની સહી   |  |

પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત લોન એપ્લિકેશન માટેની પાવતી  
ઓફિસ કોપી

|                                          |  |                      |  |
|------------------------------------------|--|----------------------|--|
| એપ્લિકેશન (સિસ્ટમ જનરેટેડ/મેન્યુઅલ) નંબર |  | એપ્લિકેશનની તારીખ    |  |
| આવેદક (કો) નું/ના નામ                    |  | આવેદન કરેલ લોનની રકમ |  |
| આવેદક (કો) ની સહી                        |  | શાખા અધિકારીની સહી   |  |

**પરિશિષ્ટ – IV (E)**

**મુદ્રા લોન એપ્લિકેશન ફોર્મનું પરિશિષ્ટ**

| પરિમાણો                                          | વિવરણ                     | માનદંડ                                                                   | ટિપ્પણિઓ<br>(ઉપયુક્ત<br>માનદંડ સિલેક્ટ<br>કરો) |
|--------------------------------------------------|---------------------------|--------------------------------------------------------------------------|------------------------------------------------|
| આવેદક (કો) નું/ના નામ                            | 1.<br>2.                  |                                                                          |                                                |
| ઉદ્યમનું નામ                                     |                           |                                                                          |                                                |
| લોનની રકમ                                        | રૂપિયા.                   |                                                                          |                                                |
| રહેઠાણનું સરનામું                                |                           | પોતે જ માલિક                                                             | હા / ના                                        |
|                                                  |                           | જીવનસાથી માલિક                                                           | હા / ના                                        |
|                                                  |                           | માતા-પિતા માલિક                                                          | હા / ના                                        |
|                                                  |                           | ભાડા પર                                                                  | હા / ના                                        |
| એસબીઆઈ/ અન્ય બેંક સાથે<br>વર્તમાન / ભૂતકાળની લોન | બેંકનું નામ :             |                                                                          |                                                |
|                                                  | લોન ખાતા નંબર.            |                                                                          |                                                |
|                                                  |                           | ચુકવણી નિયમિત                                                            | હા / ના                                        |
|                                                  |                           | લોન ખાતું વિલંબથી<br>ચુકવણી સાથે સ્ટાન્ડર્ડ છે<br>(આરજી -1 સુધી)         | હા / ના                                        |
|                                                  |                           | કોઈ લોન નહીં                                                             | હા / ના                                        |
| બેંક સાથે સંબંધ                                  | બેંકનું નામ :             |                                                                          |                                                |
|                                                  |                           | એસબીઆઈ સાથે<br>સંતોષજનક સંબંધ >3<br>વર્ષ                                 | હા / ના                                        |
|                                                  |                           | અન્ય બેંક સાથે<br>સંતોષજનક સંબંધ >3<br>વર્ષ                              | હા / ના                                        |
|                                                  |                           | એસબીઆઈ અથવા<br>અન્ય બેંક સાથે 1-3<br>વર્ષની સંતોષજનક<br>સંબંધ            | હા / ના                                        |
|                                                  |                           | કોઈ બેંકિંગ સંબંધ નહીં<br>અથવા કોઈ પણ બેંક<br>સાથે 1 વર્ષથી ઓછો<br>સંબંધ | હા / ના                                        |
| સરકારી કચેરીઓ સાથે<br>રજીસ્ટર થયેલ               | જીએસટી રજીસ્ટ્રેશન<br>નં. |                                                                          | હા / ના                                        |
|                                                  | ઉદ્યોગ આધાર નં.           |                                                                          | હા / ના                                        |

|                                                                                                                                        |                                                  |                                                                                 |         |
|----------------------------------------------------------------------------------------------------------------------------------------|--------------------------------------------------|---------------------------------------------------------------------------------|---------|
|                                                                                                                                        | એમએસએમઈ<br>રજીસ્ટ્રેશન નં.                       |                                                                                 | હા / ના |
|                                                                                                                                        | દુકાન અને સ્થાપના<br>અધિનિયમ રજીસ્ટ્રેશન<br>નંબર |                                                                                 | હા / ના |
|                                                                                                                                        |                                                  | રજીસ્ટર થયેલ નથી                                                                | હા / ના |
| કૌશલ્ય                                                                                                                                 | નામ :                                            |                                                                                 | હા / ના |
| પ્રમાણપત્રસઅભ્યાસક્રમ/<br>આરસેટી / આઈટીઆઈ<br>પૂર્ણ                                                                                     |                                                  | કોઈ પ્રમાણપત્ર<br>અભ્યાસક્રમ નથી કર્યો                                          | હા / ના |
| આઈટીઆર ફાઈલીંગ /<br>આવકનો નિયમિત સ્રોત /<br>મંજૂરકર્તા પ્રાધિકારી ને<br>સ્વીકાર્ય હોય તેવો આવકનો<br>પુરુષ<br>(શિશુ લોન માટે લાગૂ નહીં) | નવીનતમ નાણાકીય<br>વર્ષનું ફાઈલ કરેલ<br>આઈટીઆર    |                                                                                 | હા / ના |
|                                                                                                                                        |                                                  | આઈટીઆર ફાઈલ કરેલ<br>ના હોય પરંતુ બેંક ખાતા<br>દ્વારા આવકને પ્રમાણિત<br>કરી શકાય | હા / ના |
|                                                                                                                                        |                                                  | આવક પ્રમાણિત કરી<br>શકાય તેમ નથી                                                | હા / ના |
| છેલ્લા છ મહીનામાં બચત/<br>ચાલુ ખાતામાં ક્રેડિટનો<br>સરવાળો (નવા વ્યવસાય<br>માટે લાગુ પડતું નથી)                                        | એસબી / સીએ નં.<br>ક્રેડિટનો સરવાળો<br>(રુપિયા)   |                                                                                 |         |
| વાર્ષિક ટર્નઓવર<br>(નવા વ્યવસાય માટે લાગુ<br>પડતું નથી)                                                                                | રુપિયા                                           |                                                                                 |         |

(ઉપર દર્શાવેલ માહિતી ના દસ્તાવેજ પ્રમાણ ગ્રાહક પાસેથી મેળવી રેકૉર્ડ પર રાખવામાં આવે.)

**ઘોષણા :** હું/અમે આથી પ્રમાણિત કરીએ છીએ કે મેં/અમે પ્રસ્તુત કરેલી માહિતી સત્ય, સાચી અને પૂર્ણ છે. એપ્લિકેશનમાં દર્શાવેલ માહિતી સિવાય યૂનિટ માટે મારી/અમારી કોઈ દેણદારી વ્યવસ્થાઓ નથી. મારી/અમારી પાસેથી કોઈ બાકી લેણા/કાનૂની લેણા નીકળતા નથી. મારી/અમારી એપ્લિકેશનના સંબંધમાં બેંકને જરૂર હોય તેવી અન્ય તમામ પ્રકારની માહિતી હું/અમે પ્રસ્તુત કરીશું. આ માહિતી તમને યોગ્ય લાગે તે અન્ય એજેન્સીને પણ તમે આપી શકો છો. તમે, તમારા પ્રતિનિધિઓ અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અથવા મુદ્રા વિમિટેડ અથવા તમારા દ્વારા પ્રાધિકૃત કોઈ અન્ય એજેન્સી ઉપર દર્શાવેલ અમારા ફેક્ટરી/વ્યવસાય પરિસરમાં કોઈપણ સમયે મારી/અમારી સંપત્તિઓ, ખાતા વહીવટી વગેરેનું તપાસ/નિરીક્ષણ કરી શકો છો. તમે બેંકની બાકી નીકળતી રકમ માટે યોગ્ય સલામતી/પગલા લઈ શકો છો.

**આવેદક (કો) ની સહી :**

**આવેદક (કો) નું/ના નામ :**



સ્થાન :

તારીખ :

#### પરિશિષ્ટ – IV (F)

(આ ચેક લિસ્ટ ફક્ત સંકેતાત્મક છે અને સંપૂર્ણ નથી તથા અલગ અલગ સ્થાનોની સ્થાનિક આશયકતાઓને ધ્યાનમાં રાખીને જરૂરી ઉમેરો કરી શકાય છે.)

#### ચેક લિસ્ટ : શિશુ

1. ઓળખનો પુરાવો - મતદાતા ઓળખ કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસેન્સ / પાન કાર્ડ / આધાર કાર્ડ / પાસપોર્ટ/ સરકારી પ્રાધિકારી દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ ફોટો આઈડી વગેરેની સ્વપ્રમાણિત નકલ
2. શૈક્ષણિક લાયકાતનો પુરાવો
3. રહેઠાણનો પુરાવો - વ્યક્તિ/ પ્રોપ્રાઇટર/ ભાગીદાર નું હાલનું ટેલીફોન બિલ, વિજળી બિલ, પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ, મતદાતા ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, સરકારી પ્રાધિકારી/ સ્થાનીય પંચાયત/ નગરપાલિકા દ્વારા ઇશ્યુ કરવામાં આવેલ પ્રમાણપત્ર વગેરે .
4. 6 મહિનાથી જુનો ન હોય તેવો આવેદકનો હાલનો ફોટો (2 કોપી)
5. અ.જા./અ.જ.જા./અ.પ.વ./લઘુમતી, જે લાગુ પડતું હોય.
6. વ્યવસાય ઉદ્યમનો ઓળખ / રહેઠાણનો પુરાવો - જો ઉપલબ્ધ હોય.  
i.(વ્યવસાયિક યૂનિટની માલિકી, ઓળખ અને રહેઠાણ સંબંધી લાઇસેન્સ/રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર/અન્ય દસ્તાવેજોની નકલો.)
7. વર્તમાન બેંકરનું છેલ્લા છ મહીનાનું ખાતાનું સ્ટેટમેન્ટ, જો હોય તો.
8. મશીનરી / અન્ય વસ્તુઓના કોટેશન, કે જેની ખરીદી કરવાની હોય.

#### ચેક લિસ્ટ : કિશોર અને તરુણ :

1. ઓળખનો પુરાવો - મતદાતા ઓળખ કાર્ડ / ડ્રાઇવિંગ લાઇસેન્સ / પાન કાર્ડ / આધાર કાર્ડ / પાસપોર્ટ વગેરેની સ્વપ્રમાણિત નકલ

2. શૈક્ષણિક લાયકાતનો પુરાવો
3. રહેઠાણનો પુરાવો - હાલનું ટેલીફોન બિલ, વિજળી બિલ, પ્રોપર્ટી ટેક્સ રિસિપ્ટ (2 વર્ષથી જુની નહીં) , મતદાતા ઓળખ કાર્ડ, આધાર કાર્ડ, વ્યક્તિ/ પ્રોપ્રાઈટર/ ભાગીદાર નો પાસપોર્ટ, વગેરે
4. આય કર રિટર્નની કોપી (જો હોય તો) / અન્ય આવકના પુરાવા - જો ઉપલબ્ધ હોય
5. અ.જા./અ.જ.જા./અ.પ.વ./લઘુમતી, જે લાગુ પડતું હોય.
6. વ્યવસાય ઉદ્યમનો ઓળખ / રહેઠાણનો પુરાવો - વ્યવસાયિક યૂનિટની માલિકી, ઓળખ અને રહેઠાણ સંબંધી લાઈસેન્સ/રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર/અન્ય દસ્તાવેજોની નકલો.
7. આવેદક કોઈપણ બેંક/નાણાંકીય સંસ્થાનો ડિફોલ્ટર ના હોવો જોઈએ.
8. હાલના બેંકર પાસેથી ખાતાનું સ્ટેટમેન્ટ (પાછલા છ મહીનાનું), જો હોય તો.
9. વર્તમાન યૂનિટની છેલ્લા બે વર્ષની બેલેન્સશીટ (ઓડિટ વગરની/સ્વ-પ્રમાણિત) આય કર/ વેચાણ કર રિટર્ન વગેરે સાથે . (રુપિયા 2 લાખ અને વધુના બધાજ મામલામાં લાગુ).
10. કાર્યકારી મૂડી સીમાઓ માટે એક વર્ષની અંદાજીત બેલેન્સ શીટ અને ટર્મ લોન માટે લોનની સમયમર્યાદા સુધીની અંદાજીત બેલેન્સ શીટ (રુપિયા 2 લાખ અને વધુના બધાજ મામલામાં લાગુ).
11. વર્તમાન નાણાંકીય વર્ષ દરમિયાન આવેદન પ્રસ્તુત કરવાની તારીખ સુધીનું વેચાણ.
12. વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ (પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે).
13. કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન / ભાગીદારોનું પાર્ટનરશીપ ડીડ વગેરે.
14. અન્ય પક્ષકારની ગારંટી ના હોય તો, લોન લેનારની સાથે સાથે ડાયરેક્ટર અને ભાગીદારો પાસેથી સંપત્તિ અને દેયતાઓનું સ્ટેટમેન્ટ માંગી શકાય જેથી નેટ વર્થ જાણા શકાય.
15. માલિક/ ભાગીદારો/ ડાયરેક્ટરોના ફોટાની (2 કોપી).

\*\*\*\*\*

### ડિજિટલ યાત્રા માટે

1. ઉદ્યમ રજિસ્ટ્રેશન નંબર અનિવાર્ય છે.
  2. છેલ્લા 12 મહીનાનું ખાતાનું સ્ટેટમેન્ટ.
  3. વેચાણની માહિતી જીએસટી નંબર સાથે.
- (પોર્ટલ પર ખાતાનું સ્ટેટમેન્ટ અને અન્ય દસ્તાવેજો ફક્ત પીડીએફ માં અપલોડ કરવા)